

માર્ચ 16, 2018

બ્રામ્પટનમાં પબ્લિક ટ્રાન્ઝિટને (જાહેર પરિવહનને) આકાર આપવામાં મદદરૂપ થાવ

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સપ્ટેમ્બરમાં આયોજનબદ્ધ સેવા સુધારાઓ અમલમાં મૂકતા પહેલાં બ્રામ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરતા સવારો (રાઈડર્સ) અને બ્રામ્પટન રહેવાસીઓને સેવા અંગે પ્રતિસાદ આપવા અને બ્રામ્પટનમાં પબ્લિક ટ્રાન્ઝિટને આકાર આપવામાં મદદરૂપ થવા નિમંત્રિત કરવામાં આવે છે.

બ્રામ્પટન ટ્રાન્ઝિટના કર્મચારીઓ દરખાસ્ત લેકળનો માર્ગ અને સમયપત્રકમાં ફેરફારો રજૂ કરવા અને યોજનાઓને અંતિમ ઓપ આપવામાં આવે તે પહેલાં જાહેર સૂચનો મેળવવા સમગ્ર શહેરમાં વિવિધ સ્થળોએ હાજર રહેશે.

મંગળવાર, માર્ચ 20

બપોરે 3 – સાંજે 6 વાગ્યા સુધી
બ્રેમલી ટર્મિનલ
160 સેન્ટ્રલ પાર્ક ડ્રાઈવ

સોમવાર, માર્ચ 26

બપોરે 3 – સાંજે 6 વાગ્યા સુધી
ડાઉનટાઉન ટર્મિનલ
8 નેક્સન સ્ટ્રીટ

બુધવાર, માર્ચ 21

બપોરે 4 – સાંજે 7 વાગ્યા સુધી
ક્લિસ ગિબ્સન રિક્રિએશન સેન્ટર
125 મેકલાક્લિન રોડ

મંગળવાર, માર્ચ 27

બપોરે 4 – સાંજે 7 વાગ્યા સુધી
ગૌર મેડોસ કમ્યુનિટી સેન્ટર
10150 ધી ગૌર રોડ

ગુરુવાર, માર્ચ 22

બપોરે 4 – સાંજે 7 વાગ્યા સુધી
ક્રાસી કેમ્પબેલ કમ્યુનિટી સેન્ટર
1050 સેનડલવૂડ પાર્કવે વેસ્ટ

બુધવાર, માર્ચ 28

સવારે 11 – બપોરે 2, બપોરે 3 – સાંજે 6 વાગ્યા સુધી
બ્રામ્પટન ગેટવે ટર્મિનલ
501 મેઈન સ્ટ્રીટ સાઉથ

દરખાસ્ત લેકળના સર્વિસ સુધારાઓની સાથે સાથે ઓનલાઈન કોમેન્ટ્સ ફોર્મ જોવા માટે સોમવાર, માર્ચ 19 થી શરૂ કરીને વેબસાઈટ www.bramptontransit.com પર પણ ઉપલબ્ધ થશે.

વર્ષ 2017 માં, બ્રામ્પટન ટ્રાન્ઝિટની ઓળખ સવારીઓની સંખ્યામાં અણુધાર્યો 18 ટકાના વધારા સાથે કેનેડામાં સૌથી ઝડપથી વિકસી રહેલી ટ્રાન્ઝિટ સર્વિસ પૂરી પાડનાર તરીકે થઈ હતી. ગ્રાહકો અને કર્મચારીઓનો પ્રતિસાદ મેળવીને, બ્રામ્પટન ટ્રાન્ઝિટ પોતાની વેગીલી વૃદ્ધિને સહાયબદ્ધ થઈને સેવા સુધારવા સતતપણે કાર્યરત છે.

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca